



ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ


પ્રાદેશિક મેનેજરશ્રી-૨ની કચેરી
(ગુજરાત સરકાર સ્થાપિત ઉપક્રમ)

પ્લોટ નં.સી-૫/૧૦૧, ચાર રસ્તા

જીઆઈડીસી, વાપી - ૩૮૬ ૧૯૫. જી.વલસાડ

☎ (ફોન) ૦૨૬૦-૨૪૩૨૬૬૭ / ૨૪૩૨૬૭૦ ☎ (ફેક્સ) ૦૨૬૦-૨૪૨૦૫૦૨

ઈ-મેઈલ : rmvapi2@gidcgujarat.org



નં.જીઆઈડીસી/પ્રા.મે.-૨/વાપી/

તારીખ :

પૂર્ણ વિકસિત વસાહતોમાં ઉપલબ્ધ ઔદ્યોગિક/ વાણિજ્ય પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ઉમરગામ અને સરીગામ ઔદ્યોગિક વસાહતોમાં નીચે મુજબના ઉપલબ્ધ ઔદ્યોગિક પ્લોટ/વાણિજ્ય પ્લોટ “જેમ છે તેમ, અને જે સ્થિતિમાં તે સ્થિતિમાં” જાહેર હરાજીથી ફાળવવાના હોય, આ માટેના અરજીપત્રક (રૂ.૫૦/- + જીએસટી રોકડા ચુકવવાથી આપવામાં આવશે.) ઉપલબ્ધ ઔદ્યોગિક, પ્લોટો/ વાણિજ્ય પ્લોટો અને શરતો, વિગેરેની માહિતી, પ્રાદેશિક મેનેજરશ્રી-૨ ની કચેરી, પ્લોટ નં.સી-૫/૧૦૧, ચાર રસ્તા, જીઆઈડીસી, વાપી પાસેથી તા. ૦૪/૦૯/૨૦૧૯ થી તા.૧૬/૦૯/૨૦૧૯ સુધીમાં રજાના દિવસો સિવાય કચેરી ખાતે બપોરના ૧૨.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન મળી રહેશે. ભરેલા અરજી પત્રકો સીલબંધ કવરમાં “રજી.પો.એ.ડી.” થી મોડામાં મોડા તા.૨૩/૦૯/૨૦૧૯ ના રોજ સાંજે ૦૫.૦૦ કલાક સુધીમાં પ્રાદેશિક મેનેજરશ્રી-૨ ની કચેરીએ મળે તે રીતે મોકલવાના રહેશે. અરજીપત્રકના કવર ઉપર સ્વચ્છ અને સ્પષ્ટ રીતે જે તે મિલકતના નંબર અને વસાહતના નામનો નિર્દેશ કરવાનો રહેશે.

અરજદાર દ્વારા ૨ (બે) અલગ-અલગ ડિમાન્ડ ડ્રાફ્ટ “જી.આઈ.ડી.સી.” ના નામના પેચેબલ “વાપી” નીચે મુજબ રજુ કરવાના રહેશે.

(અ) ચકાસણી ફી પેટે રૂ. ૧૧૮૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે (નોન-રીફન્ડેબલ)

(બ) અરજીપત્રક / ભાવ પત્રકમાં ભરેલી રકમના ૨૫% પ્રમાણેની રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે.

જે અરજદારો દ્વારા ટેન્ડરની તમામ શરતોની પૂર્તતા કરવામાં આવશે, તેઓ જાહેર હરાજીમાં ભાગ લઈ શકશે. અરજીપત્રક /ભાવપત્રકમાં ભરેલી રકમના ૨૫% પ્રમાણેની ઈ.એમ.ડી.ની રકમનો ડી.ડી. સામેલ ન રાખનારનું ટેન્ડર સ્વીકારવા પાત્ર ન હોય અરજી પત્રક રદબાતલ ગણાશે. ટેન્ડર ઓપન થયેથી જે તે મિલકતની સૌથી વધારે કિંમત દર્શાવવામાં આવેલ હશે તે કિંમતને ન્યુનતમ/તળીયાની કિંમત ગણતરીમાં લઈ અરજદારો દ્વારા માંહેમાંહેની બોલી બોલાવી જે સૌથી વધારે ભાવ બોલનારની બોલી આખરી ગણી નિગમની વડી કચેરીએથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ મિલકતની ફાળવણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપલબ્ધ દર્શાવેલી મિલકતોની જાહેર હરાજી તા.૦૧/૧૦/૨૦૧૯ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે થી નીચે જણાવેલ સરનામે રાખવામાં આવશે. જેમાં ભરેલ અરજીપત્રક/ટેન્ડરના અરજદારે જ અચૂક હાજર રહેવાનું રહેશે, પછીથી કોઈ વાદવિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

મળેલ ભાવપત્રક ખોલવાનું સ્થળ: પ્રા.મે.શ્રી-૨ ની કચેરી,જી.આઈ.ડી.સી વહીવટી બિલ્ડીંગ, પ્લોટ નં.સી-૫/૧૦૧, ચાર રસ્તા, જીઆઈડીસી, વાપી - ૩૮૬ ૧૯૫.

ઉપર જણાવેલ મિલકતોની વિગતો શરતો અને અન્ય માહિતી કચેરીના નોટીસ બોર્ડ તથા નિગમની વેબસાઈટ (www.gidc.gov.in) પર મુકવામાં આવેલી છે. અનિવાર્ય સંજોગોમાં આમા ફેરફાર કરી શકાશે. સંપૂર્ણ વિગત સાથે મળેલાં અરજીપત્રકો પૈકી કોઈ પણ એક કે તમામ અરજીપત્રકો સ્વીકારવા કે કેમ? તે અંગેનો નિગમનો અબાધિત અધિકાર રહેશે.

આ હરાજીમાં ભાગ લેનાર સૌને જાણ કરવામાં આવે છે કે જી.આઈ.ડી.સી.ની મિલકત પર બીજી સંસ્થાઓ જેવી કે ડી.જી.વી.સી.એલ., નોટીફાઈડ એરિયા, સેન્ટ્રલ એક્સાઈઝ, પાણી વગેરેના જે પણ બાકી લહેણાં ભરવાના નીકળતા હોય, તેની જાણકારી અરજદારોએ મેળવી લેવી તથા આ હરાજીમાં ભાગ લેનાર જે પણ પસંદ થાય તેને નિગમની હરાજીની જે-તે મિલકત પરના બાકી લહેણાં ભરવાઈ કરવાના રહેશે, તે સંબંધિત સંપૂર્ણ જવાબદારી હરાજીમાં પસંદ થયેલ ફાળવણીદારની રહેશે, નિગમની કોઈ જવાબદારી રહેશે નહીં.

ક્રમ નં.	મિલકત નંબર	વિસ્તાર (ચો.મી. માં)	પ્લોટની રીઝર્વ કિંમત (રૂ. માં)	બાનાની રકમ (રૂ. માં) (૨૫%) તળીયાની કિંમત પ્રમાણે
ઉમરગામ ઔદ્યોગિક પ્લોટની વિગત				
૧	૧૬૧૧	૧૭૭૮.૧૮	૧,૩૩,૩૬,૪૨૫/-	૩૩,૩૪,૧૦૬/-
૨	૧૬૧૨	૨૦૬.૪૧	૧૫,૪૮,૦૭૫/-	૩,૮૭,૦૧૯/-
સરીગામ વાણિજ્ય પ્લોટની વિગત				
૧	સીએમ-૪૬૧૮/એ	૮૭૩.૦૩	૧,૦૨,૧૬,૮૧૫/-	૨૫,૫૪,૨૦૪/-
૨	સીએમ-૪૬૧૮/બી	૨૧૩૧.૬૬	૨,૨૩,૮૨,૪૩૦/-	૫૫,૯૫,૬૦૮/-

સંપર્ક અધિકારી : વી. એચ. ઠક્કર,

હોદ્દો : પ્રાદેશિક મેનેજર,

ટેલીફોન નં. (ઓ) ૦૨૬૦-૨૪૩૨૬૬૭ / ૨૪૩૨૬૭૦

સહી/-

પ્રાદેશિક મેનેજર-૨

જીઆઈડીસી, વાપી.